

Asking and Giving Directions

Class Objective:

I will be able to ask as well as give directions appropriately in Gujarati.

Concept A: Vocabulary

English	Gujarati
Asking	પૂછવું (Puchvu)
Giving	આપવું (Aapvu)
Directions	દિશાઓ (dishao)
Excuse me	માફ કરશો (maff karsho)
Post office	પોસ્ટ ઓફીસ (post office)
Pharmacy	ફાર્મસી (farmacy)
Police station	પોલીસ સ્ટેશન (police station)
Hospital	હોસ્પિટલ (hospital)
Bus stop	બસ સ્ટોપ (bus stop)
Airport	એરપોર્ટ (airport)/ હવાઈમથક (Havai mathak)
Temple	મંદિર (mandir)
Situated	સ્થિત (sthit)
Office	કચેરી (kacheri)
Address	સરનામું (sarnamu)
Straight	સીધા (sidha)
Right	જમણી (jamni)
Left	ડાબે (dabe)
Opposite	વિરુદ્ધ (virudhh)
Library	પુસ્તકાલય (pustkalay)
Intersection	આંતરછેદ (aanterched)
Bridge	બ્રિજ (bridge)

1. **Introduction**

2. **Background**

3. **Method**

- 1. **Study Design**
- 2. **Participants**
- 3. **Intervention**

4. **Results**

- 1. **Primary Outcome**
- 2. **Secondary Outcome**
- 3. **Subgroup Analysis**

5. **Conclusion**

- 1. **Summary**

6. **References**

7. **Appendix**

8. **Supplementary Materials**

9. **Notes**

- 1. **Notes**
- 2. **Notes**
- 3. **Notes**

10. **References**

1. **Introduction**

2. **Background**

3. **Method**

- 1. **Study Design**
- 2. **Participants**
- 3. **Intervention**

4. **Results**

- 1. **Primary Outcome**
- 2. **Secondary Outcome**
- 3. **Subgroup Analysis**

5. **Conclusion**

- 1. **Summary**

6. **References**

7. **Appendix**

8. **Supplementary Materials**

9. **Notes**

- 1. **Notes**
- 2. **Notes**
- 3. **Notes**

10. **References**

1. **Introduction**

2. **Background**

3. **Method**

- 1. **Study Design**
- 2. **Participants**
- 3. **Intervention**

4. **Results**

- 1. **Primary Outcome**
- 2. **Secondary Outcome**
- 3. **Subgroup Analysis**

5. **Conclusion**

- 1. **Summary**

6. **References**

7. **Appendix**

8. **Supplementary Materials**

9. **Notes**

- 1. **Notes**
- 2. **Notes**
- 3. **Notes**

10. **References**

1. **Introduction**

2. **Background**

3. **Method**

1. **Study Design**
2. **Participants**
3. **Intervention**

4. **Results**

1. **Baseline Characteristics**
2. **Primary Outcome**
3. **Secondary Outcomes**

5. **Conclusion**

1. **Summary**

6. **References**

7. **Appendix**

8. **Supplementary Materials**

9. **Tables**

1. **Table 1**
2. **Table 2**
3. **Table 3**

10. **Figures**

1. **Introduction**

2. **Background**

3. **Method**

1. **Study Design**
2. **Participants**
3. **Intervention**

4. **Results**

1. **Baseline Characteristics**
2. **Primary Outcome**
3. **Secondary Outcomes**

5. **Conclusion**

1. **Summary**

6. **References**

7. **Appendix**

8. **Supplementary Materials**

9. **Tables**

1. **Table 1**
2. **Table 2**
3. **Table 3**

10. **Figures**

1. **Introduction**

This document describes the system architecture and components.

2. **System Architecture**

- 1. **System Overview**
- 2. **System Components**
- 3. **System Flow**

3. **System Components**

- 1. **System Overview**
The system is designed to provide a comprehensive solution for managing data and resources. It consists of several key components that work together to ensure efficient operation.
- 2. **System Components**
The system is composed of the following main components:
 - 1. **System Overview**
 - 2. **System Components**
 - 3. **System Flow**
- 3. **System Flow**
The system flow is designed to be intuitive and easy to use, allowing users to navigate through the system with minimal effort.

4. **System Flow**

- 1. **System Overview**
The system is designed to provide a comprehensive solution for managing data and resources. It consists of several key components that work together to ensure efficient operation.

5. **System Flow**

6. **System Components**

7. **System Flow**

8. **System Components**

- 1. **System Overview**
- 2. **System Components**
- 3. **System Flow**

9. **System Flow**